



JAI SHREE RAM

TEMPLE SHREE RAMJI MANDHATA

INCORPORATED 1992

CHARITÉ CANADIENNE ENREGISTRÉE / REGISTERED CANADIAN CHARITY

8155, RUE DUROCHER, MONTREAL, QUEBEC H3N 2A8

TEL.: (514) 277-9298



શુક્રવાર, તા. ૩૧મી જાન્યુઆરી, ૨૦૨૦

મોન્ડ્રીઅલ

આદરણીય વડીલો, ભાઈઓ અને બહેનો,

નમસ્કાર,

વર્ષ ૨૦૨૦ની પહેલી પત્રિકા મોકલાવતાં આનંદની લાગણી અનુભવીએ છીએ. આશા છે આપ સૌ પરિવાર સહિત કુશળ હશો અને સર્વેની કુશળતા માટે પ્રભુ ચરણમાં પ્રાર્થના. વર્ષની શરૂવાતમાં જ આપણે સિટી ઓફ મોન્ડ્રીઅલ તરફથી શિખર નિર્માણ માટે અનિવાર્ય પરમિટ મેળવવામાં સફળ થયા છીએ અને અગાવ નક્કી થયા પ્રમાણે આપણે મંજૂર કરેલા ડ્રોઈંગ અનુસાર શિખર નિર્માણનું કાર્ય અમદાવાદ, ગુજરાત સ્થિત 'દેવગીત આર્ટ્સ એન્ડ કાફ્ટ' સાથે થયેલા કરાર અનુસાર શરૂ થઈ ચૂક્યું છે. પ્રભુ કૃપા અને આપ સર્વેના સહકારથી આ વર્ષનાં પાટોત્સવનાં શુભ અવસરે આપણાં મંદિરને શિખરથી સુશોભિત કરવા અમે પ્રયાસરત છીએ.

ગત વર્ષે આપણાં મંદિરના શિખર નિર્માણના પ્રોજેક્ટ અંતર્ગત મુરબ્બી શ્રી રાવજીભાઈ કાશીભાઈ પટેલ (આણંદ, ગુજરાત) તરફથી ખુબજ ઉદાર દાન આપણને મળ્યું હતું અને એમની સાથે સાથે વર્ષ દરમિયાન આપણાં ઘણાં પરિવારજનો તરફથી પણ શિખર નિર્માણ માટે નક્કી કરાયેલા પરિવાર દીઠ \$૧૦૦ કે તેનાથી પણ વધુ રકમ સંસ્થાને દાન રૂપે મળી છે. આ દાનનો પ્રવાહ આજે પણ ચાલુ જ છે અને અમને પૂરો વિશ્વાસ છે કે આપણાં બાકી રહેલા પરિવારજનો પણ \$૧૦૦ નું અનુદાન આપી શિખર નિર્માણની યોજનાને સફળતા પૂર્વક પરિપૂર્ણ કરવામાં જરૂરથી મદદરૂપ થાશે.

આ સાથે આપને આવનાર દિવસોમાં આયોજિત થનારા અગત્યના ધાર્મિક સત્સંગોથી માહિતગાર કરી રહ્યા છીએ જેમાં આપ સર્વેને સહકુટુંબ ભાગ લેવાનું આમંત્રણ છે.

- શ્રી મહાશિવરાત્રિ પૂજન: શુક્રવાર, તા. ૨૧મી ફેબ્રુઆરી, સાંજે ૭:૦૦ કલાકે
આ વર્ષે મહાશિવરાત્રીનું પૂજન એક જ પહોરમાં સાંજે ૭:૦૦ થી ૯:૦૦ દરમિયાન સંપન્ન થાશે. પૂજામાં ભાગ લેવા ઇચ્છતા ભક્તજનોને પોતાના નામોની નોંધ સવેળા આપણાં મંદિરના પૂજારીશ્રીઓને કરાવવા વિનંતી (૫૧૪-૨૭૭-૯૨૯૮). પૂજામાં ભાગ લેવા માટે \$૫૧ નું અનુદાન નક્કી કરવામાં આવ્યું છે.
મુખ્ય યજમાન: શ્રી મનોજભાઈ શેઠ, ભાવનગરવાળા
- શ્રી હોળીપૂજન: સોમવાર, તા. ૯મી માર્ચ, સાંજે ૭:૦૦ થી ૯:૦૦ દરમિયાન
મુખ્ય યજમાન: શ્રી વિજયભાઈ બચુભાઈ પટેલ, ખંભલાવ

- શ્રી રામ-પારાયણ સપ્તાહ: દરવર્ષ મુજબ શ્રી રામ-નવમીના પાવન અવસરે ચૈત્ર માસ દરમ્યાન “શ્રી રામ-પારાયણ” સપ્તાહનું આયોજન થાશે, સંત શ્રી તુલસીદાસ ચરિત “શ્રી રામ-ચરિત માનસ” ગ્રંથના વાંચનનો કાર્યક્રમ નીચે જણાવ્યા પ્રમાણે રહેશે.

બુધવાર તા.૨૫મી માર્ચ થી શુક્રવાર તા. ૨૭મી માર્ચ સુધી સાંજે ૭:૦૦ થી ૯:૦૦

શનિવાર તા.૨૮મી માર્ચના રોજ સવારે ૧૦:૦૦ થી ૧૨:૩૦ સુંદરકાંડના પારાયણ સહિત બપોરે ૨:૦૦ થી સાંજે ૭:૦૦ દરમ્યાન રામ-ચરિત માનસનું વાંચન.

રવિવાર તા. ૨૯મી માર્ચના રોજ બપોરે ૨:૦૦ થી સાંજે ૭:૦૦

સોમવાર તા. ૩૦મી માર્ચથી બુધવાર તા. ૧લી એપ્રિલ સુધી સાંજે ૭:૦૦ થી ૯:૦૦

- શ્રી રામ જન્મોત્સવનું પૂજન: ગુરુવાર તા.૨૭ એપ્રિલના દિને સવારે ૯:૦૦ થી બપોરે ૧૨:૦૦ દરમ્યાન સંપન્ન થાશે.

- શ્રી રામ જન્મોત્સવ પર્વની ઉજવણી: શનિવાર તા. ૪થી એપ્રિલના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા દરમ્યાન આપણાં સ્થાનિક કલાકારોના ભજન-કીર્તન સાથે હર્ષોલ્લાસથી ઉજવાવામાં આવશે. મુખ્ય યજમાન: સુલતાનપૂર વિભાગના ગામો તરફથી સામૂહિક રૂપે.


- શ્રી હનુમાન જયંતીનું પૂજન: મંગળવાર તા. ૭મી એપ્રિલના રોજ સાંજે ૬:૦૦ કલાકે “શ્રી સુંદર-કાંડ”ના પારાયણ સાથે સંપન્ન થાશે.

- શ્રી હનુમાન જયંતીની ઉજવણી: શનિવાર તા. ૧૧મી એપ્રિલે સવારે ૭:૦૦ થી ૯:૦૦ દરમ્યાન સુંદરકાંડનું પારાયણ અને ત્યારબાદ ૫૧ હનુમાન ચાલીસાના પારાયણ સાથે સંપન્ન થાશે.

મુખ્યા યજમાન: શ્રી ડાહ્યાભાઈ મોદી પરિવાર

અંતે ફરીથી આપ સર્વેને દરેક સત્સંગોમાં પધારવાનું હાર્દિક આમંત્રણ પાઠવવામા આવે છે તેમજ સંસ્થાના વહીવટને સુયોગ્ય રીતે સંચાલિત કરવા માટે આપના સલાહ સૂચનો હમેશાં આવકાર્ય છે, જે માટે આપ સર્વેને ફોન અથવા તો ઇ-મેલ દ્વારા સંપર્ક સાધવા વિનંતી છે.

લિ. કાર્યવાહક સમિતિ વતી



મંત્રી શ્રી યોગેશભાઈ સી. પટેલ
Email: ypatel@skylawn.net
Cell: 514-815-9701



સહાયક મંત્રી શ્રી જયેશભાઈ ડી. પટેલ
Cell: 514-299- 1570